



**PASUPATI
SPINNING
& WEAVING
MILLS LTD.**

CORP. OFFICE : 127-128, 1st FLOOR, TRIBHUVAN COMPLEX, ISHWAR NAGAR,
MATHURA ROAD, NEW DELHI-110065 (INDIA) PHONE : 91-11-47632200
E-mail : ho@pasupatitextiles.com ; admin@pasupatitextiles.com
Website : http://www.pasupatitextiles.com
CIN - L74900HR1979PLC009789

September 03, 2025

Listing Centre

**The Listing Department
BSE Limited,
Phiroze Jeejeebhoy Towers
Dalal Street Fort
Mumbai - 400001**

**Subject: Copies of Newspaper Advertisement – Notice of 45th Annual General Meeting (AGM),
e-voting Information and Book Closure Date(s)**

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copies of Newspaper Advertisements published in The Financial Express (English) & Jansatta (Hindi) dated 03rd September, 2025 regarding Notice of the 45th Annual General Meeting (AGM), e-voting Information and Book Closure Date (s).

The said advertisements are also available on the website of the Company www.pasupatitextiles.com

You are requested to take the above information on record and oblige.

Thanking you

Yours Faithfully

For Pasupati Spinning and Weaving Mills Ltd

**Ramesh Kumar Jain
Managing Director
DIN: 00575142**

Encl. : As above

केनरा बैंक Canara Bank Branch: Raj Nagar Extension, Ghaziabad
Email: ck4808@canarabank.com

GOLD AUCTION SALE NOTICE

The under mentioned persons are hereby informed that they have failed to pay off the liability in the loan accounts. They are therefore requested to pay off the liability and other charges and redeem the pledged securities on or before 18.09.2025 failing which the said securities will be sold by the Bank in public auction at the cost of the borrower at the Bank's premises at 11:00 A.M. on 18.09.2025 or on any other convenient date thereafter without further notice, at the absolute discretion of the Bank.

Sl No	Date of Loan	Loan Number	Gold Net Weight	Liability (Rs.)
1.	27.12.2024	125007238151	38.94 Gram	Rs. 2,17,367.11 + further interest

Borrower Name: Purni Gupta Co Vijay Gupta, Flat No. A-702, Tower J 3, Sangwan Heights, Rajnagar Extension, Ghaziabad-201017.

Note: 1) Amount outstanding should include all liabilities of the party under Gold Loans as well as any other loan/credit facility. (2) If the auction amount is not near to the value of security, discretion of the Branch Head shall be final. (3) Bank/Branch reserves right to amend/modify/cancel any of the above condition.

Notice Date: 02.09.2025 **Place:** Ghaziabad **Branch Manager**

PASUPATI FINCAP LIMITED

CIN : L70100HR1996PLC033099
Registered Office : Village Kaprawas, Dhaurahera (Dist. Rewari)
Haryana-123106

Website : www.pasupatfincap.co.in Ph. 9211515079

NOTICE OF THE 30th ANNUAL GENERAL MEETING OF THE COMPANY
NOTICE is hereby given that 30th Annual General Meeting of members of Pasupati FinCap Limited will be held on **Tuesday, September 30th, 2025, at 12.00 P.M.** through video conferencing (VC)/other audio-visual means (OAVM).

In compliance with all applicable provisions of the Companies Act, 2013 and Rules made thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with Circular No.14/2020 dated April 08, 2020, Circular No.17/2020 dated April 15, 2020, Circular No. 20/2020 dated May 05, 2020, Circular No. 02/2021 dated January 13, 2021 and read with SEBI Circular dated May 12, 2020, Circular No. 09/2023 dated September 25, 2023, Circular No. 09/2024 dated September 19, 2024 and Circular No. SEBI/HO/CFD/CMD/ICIR/P/2020/79 issued by SEBI (Circulars) read with Circular No. SEBI/HO/CFD/CMD/20/2/2019/2024/133 issued by SEBI dated October 3, 2024 and other applicable circulars issued by the Ministry of Corporate Affairs (MCA) and SEBI (Collectively called "relevant circulars"), to transact the business set out in the Notice calling the AGM.

Notice of the AGM along with the Annual Report 2024-25 has been sent through electronic mode to those Members whose email addresses are registered with the Company's Registrar and Share Transfer Agent. The Members desirous of obtaining the physical copy of Notice of the AGM along with the Annual Report 2024-25, may send the request mentioning their Folio No./DP ID and Client ID to the company at pasupatfincap@gmail.com.

The Company has also dispatched a letter containing the exact path and web link to access the full Annual Report available on the Company's website <https://www.pasupatfincap.co.in/index.html> to those who have not registered their email IDs in accordance with Regulation 36(1)(b) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Notice along with the Annual Report of the Company for FY 2024-25 is also available on the website of the Stock Exchange (i.e. BSE Limited) at <https://www.bseindia.com> and website of NSDL at <https://www.evoting.nsdl.com/> respectively.

Notice is further given that pursuant to the provisions of section 108 of the Companies Act, 2013 and the provisions of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulations, 2015, the Company is providing its members facility to exercise their right to vote by electronic means and the ordinary business and special business as set out in the Notice may be transacted through remote e-voting by NSDL and voting at AGM. The members may note the following:

- Members holding shares as on cut-off date i.e. Wednesday, 24th September 2025 may cast their vote electronically on the ordinary business/special as set out in the Notice of the AGM through electronic voting system of National Securities Depository Limited (NSDL). The voting period shall commence on Saturday, 27th September 2025 at 9:00 A.M till Monday, 29th September 2025 at 5:00 P.M.
- E-voting period shall be disabled by NSDL after the aforesaid date and time for e-voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently.
- Members of the company holding shares either in physical form or in Dematerialized form, as on the Cut-off date/Wednesday, 24th September 2025, may cast their vote electronically during the remote e-voting period. Members who have voted through Remote e-Voting will be eligible to attend the AGM. However, they will not be eligible to vote at the AGM.
- The facility for voting will also be made available during the AGM, and those members present in the AGM through VC facility, who have not cast their vote on the resolution through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through the e-voting during the AGM.

A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on cutoff date Wednesday, 24th September 2025, only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the meeting through polling papers. A person, who requires shares and become shareholder of the Company after communication of the notice and holding shares as of the cut off date can do remote e-voting by obtaining the login id and password by sending an email to evoting@pasupatfincap.com or by mentioning their Folio No./DP ID and Client ID No. However, if such shareholder is already registered with NSDL for remote e-voting then existing user id and password can be used for casting vote.

The Company has appointed Mr. Akash Goel, Practicing Company Secretary of M/s Akash & Co., Company Secretaries, as the Scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner.

Members are requested to carefully read all the notes set out in the Notice of the AGM and in particular, instructions for joining the AGM, manner of casting vote through electronic voting.

For any queries members may contact the Company at E-mail ID: pasupatfincaplimited@gmail.com or Company's Registrar and Transfer Agents, M/s. Skyline Financial Services Private Limited having their office at D-153A, First Floor, Okhla Industrial Area, Phase-I, New Delhi-110020. Contact details: Tel. : 011-40450193 to 197 & 2681283 or send an email request at the email id: compliances@skylinefra.com

For Pasupati FinCap Limited
Date : 30.08.2025
Place : Haryana

Ansul Malik
DIN : 10948189
Whole Time Director

NEWTIME INFRASTRUCTURE LIMITED

Regd. Office : Begampur Khatola, Khandas, Near Krishna Maruti, Gurgaon, Basal Road, Haryana -122001

Tel. No. : 91-9811910127,

CIN : L24239HR1984PLC040797, E-mail: newtimeinfra2010@gmail.com, Website: www.newtimeinfra.in

INFORMATION REGARDING 41st ANNUAL GENERAL MEETING AND E-VOTING

Dear Members,

The 41st Annual General Meeting ("AGM") of the members of Newtime Infrastructure Limited ("the Company") will be held on **Tuesday, 30th September, 2025 at 02:00 P.M.** at the Registered Office of the Company at **Begampur Khatola, Khandas, Near Krishna Maruti, Gurgaon, Basal Road, Haryana -122001** in compliance with the applicable provisions of the Companies Act, 2013 read with any MCA Circulars related thereto, to transact the businesses as set out in the notice of 41st AGM.

In compliance with the circulars issued by Ministry of Corporate Affairs (MCA) and Securities and Exchange Board of India (SEBI), the electronic copies of Notice of the AGM along with the Annual Report for the Financial Year 2024-25 will be only sent to shareholders whose name appear in the register of members as at the closing hours of business on **Friday, 29th August 2025** and whose email address are registered with the depository participants or with the Company or M/s Beetal Financial & Computer Services (P) Limited, (Registrars & Share Transfer Agent of the Company). The said documents will also be available at company's website at www.newtimeinfra.in and CDSL website www.evotingindia.com and also at BSE Website i.e. www.bseindia.com.

Further the Company is pleased to provide members facility to exercise their right to vote on the resolutions proposed to be passed at 41st Annual General Meeting (AGM) by electronic means ("remote e-voting"). The Company has engaged the services of Central Depository Services (India) Limited (herein after referred as "CDSL") as agency to provide remote e-voting facility. Members of the Company holding shares either in physical form or in dematerialized form, along with person whose names recorded in the Register of members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the **cut-off date of Tuesday, 23rd September 2025** shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM.

The Remote E-voting period will commence from **Saturday, September 27, 2025 (09:00 a.m. IST)** and will end on **Monday, September 29, 2025 (5:00 p.m. IST)**. The remote e-voting module shall be disabled by CDSL for voting thereafter.

Any person who have acquired shares and became member after the dispatch of the Notice of the AGM but before the "Cut-off Date" may obtain their user ID and Password for e-voting from the Company's Registrars & Share Transfer Agent, M/s. Beetal Financial & Computer Services (P) Limited, Beetal House, 3rd Floor, 99 Madangir, Behind Local Shopping Center, Near Dada Harsukhdas Mandir, New Delhi - 110062, Tel: 011-29981281-83 Email: investor@beetalfinancial.com.

However, if the member is already registered with CDSL for remote e-voting then he/she can use his/her existing user ID and password for casting the vote through e-voting. Members who have cast their votes by remote e-voting prior to the meeting may attend the meeting held in physical mode but shall not be entitled to cast their vote again at the AGM. If you have any queries or issues regarding E-Voting you can write an email to helpdesk.evoting@cdsindia.com or contact at 022-23058738 and 022-23058542/43.

It is also requested to all the shareholders to update their Email IDs for supply of Annual Reports, Notice of AGM and other communications from the Company. Further, up-dated Bank details will enable electronic credit of dividends, if so, declared by the Company in future, without any delay and banking hassles for shareholders.

Shareholders holding shares in dematerialized form are requested to approach their respective Depository Participants (DPs) for updating the Email address, Mobile No. and Bank Mandates as per the laid down procedure with the RTA/ Depository.

In case of Physical Holding:

Shareholders holding shares in physical form are requested to send following details to the Company's Registrar and Share Transfer Agent i.e. Beetal Financial & Computer Services (P) Limited having office at Beetal House, 3rd Floor, 99, Madangir, Behind LSC, New Delhi - 110062 at investor@beetalfinancial.com and beetalraa@gmail.com in order to facilitate for sending the Notice of Annual General Meeting, Annual Report and other important communications in electronic mode. Members may access the relevant forms available on the website of the Company at www.newtimeinfra.in

Details: Full Name; Address; Email address; Mobile No.; No. of Shares held; Folio No., Certificate No.; Distinctive No.; Original scan copy of PAN and Aadhar Card; Original scan copy of Cancelled Cheque or Passbook signed by Bank Manager with IFSC & MICR No. (For Bank Mandate).

In case of Demat Holding:

Members holding shares in dematerialized mode are requested to register/update their email addresses with the relevant Depository Participants with whom they maintain their demat accounts.

Please note that the Members who have not provided their email address will not be able to get the Notice of AGM and Annual Report for the Financial Year 2024-25. However, the same will be available on the website of the Company/ Stock Exchange i.e. www.newtimeinfra.in, www.bseindia.com and www.nseindia.com in due course of time.

For further information, Members can write to the Company/RTA of the Company at newtimeinfra2010@gmail.com or investor@beetalfinancial.com.

For Newtime Infrastructure Limited
Date: 03.09.2025
Place: Gurugram, Haryana

Sd/-
Ms. Jyoti Verma
Company Secretary & Compliance Officer

FORM NO. [See Regulation 33(2)]

OFFICE OF THE RECOVERY OFFICER - VII
DEBTS RECOVERY TRIBUNAL DELHI (RT 2)
4th Floor, Jeevan Tara Building, Parliament Street,
New Delhi-110001

NOTICE UNDER AND RULE 53 OF SECOND SCHEDULE TO THE INCOME TAX ACT, 1961 READ WITH THE SECTION 25-29 OF RECOVERY OF DEBTS & BANKRUPTCY ACT, 1993.

RC/13/2024 23-07-2025

PUNJAB NATIONAL BANK
Versus
M/S B.S. TRADING CO.,

To,
The Concerned Officers:-
1. Jal Board/Health Dept.
2. Municipal Corporation
3. Income Tax, Sales Tax/VAT etc.
4. Electricity Deptt.

It is being proposed to auction the following property for recovering the dues of the CH Bank/Cn Financial Institution:-

Specification of property
H. No. 46, area measuring 125 sq. yds., Kharsa No. 29/19/16 (part of Kharsa no. 26/19), Village Dabri, Abadi known as Dabri Extn., Near Sitapuri, Block-G-1, New Delhi.

You are hereby directed to disclose your dues, if any, on the said property within one month from the date of issue of this notice, failing which, it shall be presumed that there are no dues on the said property towards your department.

Given under my hand and the seal of the Tribunal, on this date: 23/07/2025

Recovery Officer
DEBTS RECOVERY TRIBUNAL DELHI (RT 2)

PASUPATI SPINNING AND WEAVING MILLS LIMITED

CIN : L74901HR1979PLC009169

Regd. Office: Village Kaprawas, Dhaurahera, Distt. Rewari, Haryana Head Office: 127-128, Tribhuvan Complex, Ishwar Nagar, Mathura Road, New Delhi-110065, Phone: +91-11-47652200

Website: www.pasupatitextiles.com

INFORMATION REGARDING 45th ANNUAL GENERAL MEETING TO BE HELD ON SEPTEMBER 30th, 2025

Dear Members,

The 45th Annual General Meeting ("AGM") of the members of Pasupati Spinning and Weaving Mills Limited ("the Company") will be held on **Tuesday, 30th September, 2025 at 11:00 A.M.** at the Registered Office of the Company at Village Kaprawas (Dhaurahera), Distt. Rewari, Haryana to transact the businesses as set out in the notice of AGM in compliance with the applicable provisions of the Companies Act, 2013 (Act) and Rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Company has engaged the services of National Securities Depository Limited ("NSDL") as the authorized agency to provide the facility of Remote e-voting before AGM and e-voting during AGM.

The remote e-voting period shall commence on 27th September, 2025 (9:00 am) and ends on 29th September, 2025 (5:00 pm). During this period, members of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date of 23rd September, 2025, may cast their vote by e-voting. The remote e-voting module shall be disabled by NSDL for voting there after. Once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently.

Further, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from 24th September, 2025 to 30th September, 2025, both days inclusive, for annualizing.

The Notice of 45th AGM and Annual Report for the Financial Year 2024-25 have been sent through electronic mode to those members, whose e-mail addresses is registered/ available with the Company's Depository Participant(s). Additionally, a letter containing the web link for accessing the notice of 45th AGM and Annual Report for the financial year 2024-25 is also being sent at the registered address of those shareholders, whose email addresses are not registered with the Company/ RTA or their DP. The aforesaid documents will be available on the Company's website i.e. www.pasupatitextiles.com, website of the National Exchange i.e. BSE Limited at www.bseindia.com and website of Stock Exchange Depository Limited ("NSDL") at www.evoting.nsdl.com/

The members will have an opportunity to cast their vote electronically on the businesses set out in the AGM Notice through remote e-voting. The shareholders attending the 45th AGM who have not cast their vote by remote e-voting shall be able to exercise their right to vote at the 45th AGM through ballot paper. Further, the detailed procedure for remote e-voting and voting through ballot paper during the AGM is provided in the Notice of AGM.

Members who have not registered their e-mail address with the Company's Depository Participant(s) are requested to register their email addresses by performing instructions given below for the purpose of obtaining e-voting User ID & Password. Notice of AGM and Annual Report 2024-25 and updation of Bank Account Details.

Physical Holding

Send email to cs@pasupatitextiles.com mentioning the Folio No., name address along with the copy of the share certificate (front/ back), self-attested copy of the PAN card and self-attested copy of any document in support of the address of the shareholder for the purpose of obtaining e-voting User ID & Password. Notice of AGM and Annual Report 2024-25.

For updation of Bank Account Details, please provide (i) Bank Account Number (ii) Bank Name and Branch Address (iii) MICR Number (iv) IFSC Code (v) Cancelled cheque leaf or copy of Bank Passbook / Bank Statement duly attested by the Bank.

For Pasupati Spinning and Weaving Mills Limited (NSDL), at www.evoting.nsdl.com/

Demat Holding

Please update e-mail address / Bank Account Details with your Depository Participant(s) (DP).

For Pasupati Spinning and Weaving Mills Limited

Deepika Malhotra
(Company Secretary)
M. No. : 2866

Date : 02.09.2025
Place : New Delhi

Court Notice / Summons

Form No. 5
DEBTS RECOVERY TRIBUNAL
600/1, University Road, Near Hanuman Setu Mandir, Lucknow - 226007.

(Area of Jurisdiction-Part of Uttar Pradesh)
Summons for filing Reply & Appearance by Plaintiff

O. A. No. 709/2023 **Date: 18/08/2025**
(Summons to defendant(s) under Section 19(3), of the Recovery of Debts due to Banks and Financial Institutions Act, 1993 read with Rules 12 and 13 of the Debts Recovery Tribunal (Procedure Rules) 1993).

Canara Bank, District Ghaziabad Applicant
Versus
Shri Sandeep Jaiswal & others Defendants

To,
1. M/s Morpheus Developers Pvt. Ltd., Through its Director Registered Office at House No. 3/5, Mandir Wali Gali Majpur, Delhi - 110053 (Defendant No. Shive).

In the above noted application, you are required to file reply in paper book from in Two sets alongwith documents and affidavits (if any), personally or through your duly authorized agent or legal practitioner in this Tribunal, after serving copy of the same on the applicant or his counsel/ duly authorized agent after publication of the Summons, and thereafter to appear before the Tribunal on 17/03/2025 at 10:30 A.M. failing which the application shall be heard and decided in your absence.

Registrar
Debts Recovery Tribunal, Lucknow

SIGNORIA CREATION LIMITED

CIN : L18208RJ2019PLC066461

Regd. Office: Plot No. H1-74, RICO Industrial Area, Mansarovar, Jaipur 302020 (Rajasthan) India Ph: 935838840 • Website: <https://signoria.in> • Email: signoria@jaipur@gmail.com

INTIMATION REGARDING NOTICE OF 6th ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 06th Annual General Meeting ("AGM") of SIGNORIA CREATION LIMITED ("the Company") will be held on **Thursday, September 25, 2025 at 01:30 P.M. (IST)**, through Video Conferencing ("VC")/other Audio-Video means ("OAVM") facility to transact the business specified in the Notice convening the AGM of the Company. The deemed venue of the meeting shall be registered office of the Company. The said notice and the Annual Report for the FY 2024-25 have been electronically sent to all the members on Tuesday, 02nd September, 2025 whose email address are registered office with the company and/or RTA Big share Services Private limited and also available on the website of the Company at <https://signoria.in/>

Instruction for remote e-voting and e-voting during the AGM

Members may note that:

- The cut-off date for the purpose of determining the Members eligible for participation in remote e-voting i.e. voting from a place other than venue of the AGM) and voting at the AGM is Thursday, 18th September, 2025. Please note that Members can opt for only one mode of voting i.e., either by voting at the meeting or remote e-voting. If Members opt for remote e-voting, then they should not vote at the Meeting and vice versa. However, once an e-vote on a resolution is cast by a Member, such Member is not permitted to change it subsequently or cast the vote again. Members who have cast their vote by remote e-voting prior to the date of the Meeting can attend the Meeting and participate in the Meeting, but shall not be entitled to cast their vote again.

- The voting period shall commence at 10:00 A.M. on Monday, 22nd September, 2025 and will end at 5:00 P.M. on Wednesday, 24th September 2025. During this period shareholders of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cutoff date (record date) i.e. Thursday, 18th September, 2025 may cast their vote electronically.

- Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after dispatch of the Notice, holds shares as on the cut-off date i.e. Thursday, 18th September, 2025, may obtain the login ID and password by sending a request at invest@bigshareonline.com.

- In case shareholders/ investor have any queries regarding E-voting, you may refer the Frequently Asked Questions (FAQs) and i-Vote e-Voting module available at <https://invest@bigshareonline.com>, under download section or you can email to invest@bigshareonline.com or call at: 1800 22 54 22.

For Signoria Creation Limited
Sd/-
Vasu Dev Agarwal
Chairman and Managing Director
DIN: 00178146

Date: 31st September, 2025
Place: Jaipur

POSSESSION NOTICE - (for immovable property) Rule 5(1)

Whereas, the undersigned being the Authorized Officer of IFL Home Finance Limited (Formerly known as India Infoline subject matter of Civil Suit No. 1327 of 2025, filed in furtherance of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 5 of the Security Interest (Enforcement) Rules, 2002, a Demand Notice was issued by the Authorised Officer of the company to the borrowers / co-borrowers mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules. The borrower in particular and the public in general are hereby cautioned to deal with the property and any dealings with the property will be subject to the charge of IFLHFL for an amount as mentioned herein under with interest thereon. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, if the borrower clears the dues of the IFLHFL together with all costs, charges and expenses incurred, at any time before the date fixed for sale or transfer, the secured assets shall not be sold or transferred by IFLHFL and no further step shall be taken by IFLHFL for transfer or sale of the secured assets.

Name of the Borrower (s) Co-Borrowers) **Description of secured asset (immovable property)** **Total Outstanding Dues (Rs.)** **Date of Demand Notice** **Date of Possession**

Mr. Anil Khatuna All that piece and parcel of Residential House Bearing No. 407 alongwith any Construction thereon situated in Block D of the residential colony known as Palm View falling within the revenue estate of Village Chausma Tehsil and District Gurugram, Haryana, 122017, Area Admeasuring (in Sq. Ft.) Property Type: Land, Area, Built Up, Area, Property Area: 3140.00, 2150.00, Bounded By: North: Plot No. H-406, South: Plot No. H-408, East: Plot No. H-378, West: Road Twenty One Only

(Prospect No. 988614)

This is further to clarify that the present possession notice does not apply to the part of the property, which is the subject matter of Civil Suit No. 1327 of 2025, filed in furtherance of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 5 of the Security Interest (Enforcement) Rules, 2002, a Demand Notice was issued by the Authorised Officer of the company to the borrowers / co-borrowers mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules. The borrower in particular and the public in general are hereby cautioned to deal with the property and any dealings with the property will be subject to the charge of IFLHFL for an amount as mentioned herein under with interest thereon. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, if the borrower clears the dues of the IFLHFL together with all costs, charges and expenses incurred, at any time before the date fixed for sale or transfer, the secured assets shall not be sold or transferred by IFLHFL and no further step shall be taken by IFLHFL for transfer or sale of the secured assets.


For Further Details Please Contact to Authorised Officer At Branch Office: Vipul Agral Mandir, First Floor, Office No. 129A to 129 D, Sector 28, M G Road, Gurgaon, Pin Code : 122002, Haryana. /or Corporate Office: Plot No 98, Phase-Iv, Udyog Vihar, Gurgaon, Haryana.

Place: Delhi **Date: 03/09/2025** **Sd/- Authorised Officer, For IFL Home Finance Limited**

SWISS MILITARY CONSUMER GOODS LIMITED

CIN : L51100DL1989PLC034797

बैंक ऑफ इंडिया



Bank of India
Relationship beyond banking

दिल्ली अरिक्त बसूली शाखा, दिल्ली एनसीआर
एम-125, ब्लॉक एम, विकासपुरी, नई दिल्ली-110018
ईमेल : arb.delhincrb@bankofindia.co.in

परिशिष्ट-IV (नियम-8(1) देखें)
कब्जे की सूचना (अचल संपत्ति के लिए)

जबकि

अधोहस्ताक्षरी, वित्तीय आसियायों के प्रतिभूतिकरण एवं पुनर्निर्माण तथा प्रतिभूति हित प्रवर्तन अधिनियम, 2002 के अंतर्गत बैंक ऑफ इंडिया के प्राधिकृत अधिकारी होने के नाते तथा प्रतिभूति हित (प्रवर्तन) नियम, 2002 के नियम 3 के साथ पठित धारा 13(12) के अंतर्गत प्रदत्त शक्तियों का प्रयोग करते हुए, दिनांक **21.06.2025** को एक आम नोटिस जारी किया, जिसमें अधोहस्ताक्षरित मेसर्स रोहन इंडस्ट्रीज को उक्त नोटिस की प्रतिलिपि के साथ 60 दिनों के भीतर नोटिस में उल्लिखित राशि **₹ 5,74,87,350.85 रुपये** (पांच करोड़ चौहत्तर लाख सत्तासी हजार बीस तीन पचास तथा पचासी पैसे) चुकाने का आह्वाहन किया गया।

अधोहस्ताक्षरित ने अधिनियम की धारा 13 की उपधारा (4) के अंतर्गत उसे प्रदत्त शक्तियों का प्रयोग करते हुए, प्रतिभूति हित (प्रवर्तन) नियम, 2002 के नियम 8 के साथ, वर्ष **2025 के अगस्त माह के 28** वे दिन नीचे दी गई संपत्ति का प्रतीकात्मक कब्जा ले लिया है।

विशेष रूप से अधोहस्ताक्षरित / गारंटर और आम जनता को इस संपत्ति से संबंधित कोई भी लेन-देन न करने की चेतावनी दी जाती है और संपत्ति से संबंधित किसी भी लेन-देन पर **बैंक ऑफ इंडिया** को रुपये **₹ 5,74,87,350.85** की राशि और चस पर खाज का भार वहन करना होगा।

अधोहस्ताक्षरित का ध्यान सुरक्षित प्रतिस्पर्धियों को भुनाने के लिए प्रपक्षक समय के संबंध में अधिनियम की धारा 13 की उपधारा (6) के प्रावधानों की ओर आकर्षित किया जाता है।

उधारकर्ता / गारंटर का नाम	अचल / चल संपत्ति का विवरण	राशि (धारा 13(2) के तहत नोटिस के अनुसार)
मेसर्स रोहन इंडस्ट्रीज प्रोपरायटीज लि. श्री गणेश प्रताप गारंटर 1. श्रीमती मीना सिंह 2. श्री रोहन सिंह	(क) आवासीय संपत्ति संख्या RZ-50 (पुरानी) RZ-87 (नई संख्या) का समतुल्य बंधक, जो प्लॉट संख्या 50, खसरा संख्या 404 और 405, गली संख्या 1, नांगल राया, पूर्वी सागरपुर, नई दिल्ली में स्थित है, जिसका क्षेत्रफल 100 वर्ग गज है। स्वामित्व श्री गणेश प्रताप सिंह के पास है। वीहरी: उत्तर: प्लॉट संख्या 51 दक्षिण: प्लॉट संख्या 49 पूर्व: रेलवे लाईन पश्चिम: सड़क	₹ 5,74,87,350.85
	(ख) औद्योगिक संपत्ति का समतुल्य बंधक प्लॉट संख्या 1750, एमआईडी पार्क-1, बहादुरगढ़, जिला झुज्जर, हरियाणा में स्थित, क्षेत्रफल 502 वर्ग गज, जिसका स्वामित्व श्रीमती मीना सिंह पत्नी श्री गणेश प्रताप सिंह के पास है। वीहरी: उत्तर: प्लॉट संख्या 1751, दक्षिण: प्लॉट संख्या 1749, पूर्व: रोड पश्चिम: अन्य संपत्ति	₹ 5,74,87,350.85
	(ग) प्लॉट संख्या 1749, एमआईडी पार्क-1, बहादुरगढ़, जिला झुज्जर, हरियाणा में स्थित औद्योगिक संपत्ति का समतुल्य बंधक, जिसका क्षेत्रफल 502 वर्ग गज है, जिसका स्वामित्व श्री गणेश प्रताप सिंह पुत्र स्वर्गीय श्री ब्रह्मा दयाल सिंह के पास है। परिसीमा: उत्तर: प्लॉट संख्या 1750 दक्षिण: प्लॉट संख्या 1748 पूर्व: रोड पश्चिम: अन्य संपत्ति	₹ 5,74,87,350.85

दिनांक : 28.08.2025

स्थान : नई दिल्ली

(सूचे सहित)

प्राधिकृत अधिकारी बैंक ऑफ इंडिया

SOBHA

SOBHA LIMITED

CIN : L45201KA1995PLC018475

Regd. Office: 'SOBHA' Sarjapur – Marathahalli Outer Ring Road (ORR),
Devarabisanahalli, Bellandur Post, Bangalore – 560 103

Ph: +91-80-49320000, Email: investors@sobha.com, Website: www.sobha.com

A MESSAGE TO OUR VALUED SHAREHOLDERS

Investor Education and Protection Fund Authority (IEPFA), Ministry of Corporate Affairs has initiated a 100 days campaign named "Saksham Niveshak" - targeting shareholders whose dividends have remained unclaimed, from July 28, 2025 to November 06, 2025.

The company through its various communication continues to encourage shareholders to claim their unclaimed dividends by updating their KYC details, (viz, PAN, Bank mandates, contact details, Nomination information, specimen signature etc.) by following the below procedure:

Type of Holding	Documents to be submitted with MUFG Intime India Private Limited (RTA)
Shares held in Demat form	1. Update KYC details with your Depository Participant, especially Bank account number, bank name and branch, IFSC code and MICR, Nomination information, etc. 2. Submit self-attested copy of Client master list (CML) to RTA or upload the same on RTA Website.
Shares held in Physical form	Submit below documents: 1. Investor Service Request Forms (i.e., Form ISR-1, Form ISR-2 and Form ISR-3 or Form No. SH-13 (Nomination form) duly filled as per the instructions stated therein along with the supporting documents. Forms are available on RTA's website at https://web.in.mpmis.mufg.com/mufg.com/KYC-downloads.html 2. Original cancelled cheque stating your name as account holder 3. Other supporting documents, if any.

Shareholders are requested to contact our Registrar and Share Transfer Agent, MUFG Intime India Private Limited (Unit: Sobha Limited), C-101, 1st Floor, 247 Park, Lal Bahadur Shastri Marg, Vikhroli (West) Mumbai – 400 083, Maharashtra, India, Tel No. : +91 8108114949, Fax No: 022-49186060, E-mail ID: rtnt.helpdesk@in.mpmis.mufg.com, Website: <https://in.mpmis.mufg.com>. Additionally, Shareholders are encouraged to register and track their requests through the swayam portal: <https://swayam.in.mpmis.mufg.com>

For SOBHA Limited

On Behalf of the Board of Directors

Sd/-

Bijan Kumar Dash

Company Secretary & Compliance Officer

Date : September 03, 2025

Place : Bangalore

[illegible]

ICICI Home Finance

સાલગણિક સૂચના

પંજીકૃત કાર્યાલય: આઈસીઆઈઆઈ બેંક ટાવર, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, બાંદ્રા (પૂર્વ), મુંબઈ- 400051
કોર્પોરેટ કાર્યાલય: આઈસીઆઈઆઈ પરફોર્મન્સ ટાવર, બાંદ્રા, મુંબઈ. અગ્રેડે કોર્પોરેટ, મુંબઈ- 400059

શાજા કાર્યાલય: પ્રથમ તલ, હસરા નં 700, સારાવાળા પુરવણા, અંબુજીનગર, મોઘવા બેચેરી અને પુલિયાસ રોડ નં ૧૭૦, લખનવુ સરકાર પ્રદેશ- 226002, શાજા કાર્યાલય: પ્રથમ તલ, મેઈકનક કોલેજ રોડ, આઈસીઆઈઆઈ બેંક કે ડ્રમ, સમાપુર, ગોલપુર નં- 273004 સારાવાળા: 200/45/4, પ્રથમ તલ, રૂંદેરા ઓફિસ, મારવાળા મોડી નાગ, દિલ્હી સરકાર, હલાવાબાદ - 211001 શાજા કાર્યાલય: દિલ્હી તલ, વ્યાં માર્કેટ, રેલ્વે સ્ટે, પુલિયાસ રોડ કે ડ્રમ, અરબેયા રોડ, વારાબેરી, ડ.પ્ર. 225001 મારવાળા: 302, 303, 304, ત્રીજા તલ, રૂંદેરા કોર્પોરેટ રોડ રૂંદેરા 58ની, મિલિયન રોડ, ગોમતીનગર, લખનવ- 226010 શાજા કાર્યાલય: ત્રીજા તલ, પ્લોટ નં. સી-03, સેન્ટર ડી, ડેમોનિયમ કોલેજ રોડ, સેન્ટર ડી, જાનકીપુર, લખનવ, ડ.પ્ર. 226021 શાજા કાર્યાલય: સી- 64/127, સીપુ, અર્ધિત કોલેજ, સિયા, વારાબેરી- 221010

શાજા કાર્યાલય: સુત્ર, 104/438, પી. રોડ, સીમાકાં, રામ ચાંડા કીના, વાગુર- 208012 શાજા કાર્યાલય: નં. 460/460/1, 460/2, વાંદ નં. 24, પ્લોટ નં. 255મુ, પ્રથમ તલ, મધુર કોમ્પ્લેક્સ, કેનાલ રોડ, રાયવોલી, ઉત્તર પ્રદેશ-229001.

નિમ્નલિખિત કલેન્ડર ને અસીઆઈઆઈ હોમ ફાઇનાન્સ કોર્પોરેટ લિમિટેડ (‘અસીઆઈઆઈ પરફોર્મન્સ’) ને શાજા ચૂકા સુધિયા કે સુધન અને ચૂકા કે ચૂકા કે પુરુષોગામી (પુલિયર) કે રપ નં વાંચીત નિમ્નલિખિત ને પા. પીઝ નેચર ડેર ડ્રમકે અર્ધિત ડાઉન ટુ લિમિટ અર્ધિત લિટ યુવર્ધન ડિપ્રીબુલિકામ અને પુર્નિર્માન યાત્રા પ્રતિનિધિ લિટ યુવર્ધન ડિપ્રીબુલિકામ ને યાત્રા 13 (2) કે તલત યાત્રી કિયા ગયા થા, સારાલિ સહ કામતી સી કિયા ગયા થા અને હરિયાલિ ડેર ડ્રમ સાર્વજનિક સૂચના કે માધ્યમ ને અધિપતિત કિયા જાતા હૈ. કર્જદાર કા યાત્રા પ્રતિનુદ્ધ પર્સનલિયટી કો લિમિતિત કરને હેતુ ડપલ્પથ સમય કે સંધ્ય નં અધિવિનય કો થારા 13 કો ઉપથારા (8) કે પ્રાવધાની કો અને આકુષ્ટ કિયા જાતા હૈ.

ક્ર.સં.	કર્જદાર/સહ-કર્જદાર/ઝમાનતી કે નામ/ (ઝણ જાણત સંખ્યા) પૂર્વ પાત	પ્રતિનુદ્ધ આર્થિક/પ્રવર્ધિત કો જાને વાલી આંશિક કા સમ્પત્તિ પાત	સૂચના મેઝને કો નિધિ સૂચના કો નિધિ તક વચવાવા	પરવર્ધિત નિધિ
1	રેનુ સિંહ (કર્જદાર), અર્ધિત કુમાર (સહ-કર્જદાર), યાદનપુર સારવાળા પ્રવાગાંજ હલાવાબાદ ઉત્તર પ્રદેશ 211012. LHALD000001581733.	આરાજી સંખ્યા 475 મૌજા સાહા ડર્ન પીપલગામી પરગના અને તલસી સરદર હલાવાબાદ ઉત્તર પ્રદેશ 211012. સીમાર્ન- ઉત્તર: 18 પંદેર યોડી કાચા રાતા, દક્ષિણ: આરાજી સંખ્યા 474 કા યાગ, પૂર્વ: સ્થિપાલ કા પ્લોટ, પશ્ચિમ: મૌજા લાલ સિંહ કા પ્લોટ	16-08-2025' ર. 3272506/-	3-આગસ્ટ-25
2	રેનુ સિંહ (કર્જદાર), અર્ધિત કુમાર (સહ-કર્જદાર), યાદનપુર સારવાળા પ્રવાગાંજ હલાવાબાદ ઉત્તર પ્રદેશ 211012. LHALD000001581734.	આરાજી સંખ્યા 475 મૌજા સાહા ડર્ન પીપલગામી પરગના અને તલસી સરદર હલાવાબાદ ઉત્તર પ્રદેશ 211012. સીમાર્ન- ઉત્તર: 18 પંદેર યોડી કાચા રાતા, દક્ષિણ: આરાજી સંખ્યા 474 કા યાગ, પૂર્વ: સ્થિપાલ કા પ્લોટ, પશ્ચિમ: મૌજા લાલ સિંહ કા પ્લોટ	16-08-2025' ર. 168730/-	3-આગસ્ટ-25
3	નીરમ કુમાર દેશિત (કર્જદાર), મુનીં દેશિત (સહ-કર્જદાર), પ્લોટ નંમર 5 કા યાગ, હસરા નંમર 62 કા હિસા, મોહલસા- રોહમ નગર દુદીલી, વાર્ડ- ફેઝુલાંગાંજ, જિલા- લખનવ- 226020 લખનવ ઉત્તર પ્રદેશ 226020 LHHBK00001490998.	હસરા સંખ્યા 62 કે યાગ પર્ નિર્મિત મકાન, રોહમનગર દુદીલી વાર્ડ- ફેઝુલાંગાંજ અને જિલા- લખનવ ઉત્તર પ્રદેશ 226018 નં મિથા. સીમાર્ન- ઉત્તર: સોમિતિ વ્યાં જી કા પ્લોટ, દક્ષિણ: 15 પંદેર યોડી સડક, પૂર્વ: સોમિતિ કા પ્લોટ, પશ્ચિમ: 10 પંદેર યોડી સડક	16-08-2025' ર. 880554.96/-	3-આગસ્ટ-25
4	નીરમ કુમાર દેશિત (કર્જદાર), મુનીં દેશિત (સહ-કર્જદાર), પ્લોટ નંમર 5 કા યાગ, હસરા નંમર 62 કા હિસા, મોહલસા- રોહમ નગર દુદીલી, વાર્ડ- ફેઝુલાંગાંજ, જિલા- લખનવ- 226020 લખનવ ઉત્તર પ્રદેશ 226020 LHHBK00001490999.	હસરા સંખ્યા 62 કે યાગ પર્ સંધિ સંધ્યા 5 કે યાગ પર્ નિર્મિત મકાન, રોહમનગર દુદીલી વાર્ડ- ફેઝુલાંગાંજ અને જિલા- લખનવ ઉત્તર પ્રદેશ 226018 નં મિથા. સીમાર્ન- ઉત્તર: સોમિતિ વ્યાં જી કા પ્લોટ, દક્ષિણ: 15 પંદેર યોડી સડક, પૂર્વ: સોમિતિ વ્યાં જી કા પ્લોટ, દક્ષિણ: 15 પંદેર યોડી સડક	16-08-2025' ર. 33720.74/-	3-આગસ્ટ-25
5	પિન્કા હુદેન ઝંસરી (કર્જદાર), સલમા વાંદી ઝંસરી (સહ-કર્જદાર), ઝોલા નવાબગંજ વારાબંકી, ત્રીજી મહિદ કે યાગ 8557 યોલા નવાબગંજ વારાબંકી વારાબંકી ઉત્તર પ્રદેશ 225001. LHHBK00001516573	આવાસીય પ્લોટ 176 મિંજુલા, ગ્રામ ફેઝુલાંગાંજ બહાર સીમા પરગના નવાબગંજ વારાબંકી, વારાબંકી ઉત્તર પ્રદેશ 225001 નં મિથા સીમાર્ન- ઉત્તર: દોમર કા પ્લોટ, દક્ષિણ: દોમર કા પ્લોટ, પૂર્વ: દોમર કા પ્લોટ, પશ્ચિમ: 15 પંદેર યોડી સડક	16-08-2025' ર. 651179.1/-	3-આગસ્ટ-25
6	પિન્કા હુદેન ઝંસરી (કર્જદાર), સલમા વાંદી ઝંસરી (સહ-કર્જદાર), ઝોલા નવાબગંજ વારાબંકી, ત્રીજી મહિદ કે યાગ 8557 યોલા નવાબગંજ વારાબંકી વારાબંકી ઉત્તર પ્રદેશ 225001. LHHBK00001516577.	આવાસીય પ્લોટ 176 મિંજુલા, ગ્રામ ફેઝુલાંગાંજ બહાર સીમા પરગના નવાબગંજ વારાબંકી, વારાબંકી ઉત્તર પ્રદેશ 225001 નં મિથા સીમાર્ન- ઉત્તર: દોમર કા પ્લોટ, દક્ષિણ: દોમર કા પ્લોટ, પૂર્વ: દોમર કા પ્લોટ, પશ્ચિમ: 15 પંદેર યોડી સડક	16-08-2025' ર. 29861.72/-	3-આગસ્ટ-25
7	મધુલાલ (કર્જદાર), ધીરેન્દ્ર કુમાર મૈર્ન (સહ-કર્જદાર), અર્ધિત કુમાર મૈર્ન (સહ-કર્જદાર), રામનગરા (સહ-કર્જદાર), મૈર્ન ધાન ખેતર હુડ મુઘાલપુર, મહારાજગંજ (સ.પ્ર. 273303, મહારાજગંજ (સ.પ્ર. 273303) ગોલપુર ઉત્તર પ્રદેશ 273302. LHGOR000001635444.	આરાજી નંમર 442, મૌજા કોપીયા તથા કુશામ નં મિથા, પરગના હવેલી તહસીલ સરદર જિલા મહારાજગંજ ઉત્તર પ્રદેશ 273301. સીમાર્ન- ઉત્તર: મુક્તિ દેવી કો બુમિ, દક્ષિણ: 9 મીટર કંદ યોડી સડક, પૂર્વ: વિનોદ કુમાર કા ખર, પશ્ચિમ: સફુતના દેવી કો બુમિ	16-08-2025' ર. 2818760.44/-	3-આગસ્ટ-25
8	દુર્ગાવતી દેવી (કર્જદાર), શ્રવણ કુમાર (સહ-કર્જદાર), 747જેઇ ઇથિયા હનુમાન મૈદ સહિદર, નાર વાંડ 22 શિવપુર ગોલપુર નાર વાંડ 22 શિવપુર ગોલપુર ગોલપુર ઉત્તર પ્રદેશ 273041. LHGOR000001520374.	મૌજા પિલિલિલવા પરકાના હવેલી તહસીલ સરદર આરાજી નંમર 802 ગોલપુર ઉત્તર પ્રદેશ 273001 નં મિથા સીમાર્ન- ઉત્તર: રામગતી મૈર્ન કો બુમિ, દક્ષિણ: શ્રવણ કો બુમિ, પૂર્વ: 6 મીટર યોડી સડક, પશ્ચિમ: ડૉ. રિયાજ કો બુમિ	16-08-2025' ર. 886589/-	3-આગસ્ટ-25
9	દુર્ગાવતી દેવી (કર્જદાર), શ્રવણ કુમાર (સહ-કર્જદાર), 747જેઇ ઇથિયા હનુમાન મૈદ સહિદર, નાર વાંડ 22 શિવપુર ગોલપુર નાર વાંડ 22 શિવપુર ગોલપુર ગોલપુર ઉત્તર પ્રદેશ 273041. LHGOR000001520407.	મૌજા પિલિલિલવા પરકાના હવેલી તહસીલ સરદર આરાજી નંમર 802 ગોલપુર ઉત્તર પ્રદેશ 273001 નં મિથા સીમાર્ન- ઉત્તર: રામગતી મૈર્ન કો બુમિ, દક્ષિણ: શ્રવણ કો બુમિ, પૂર્વ: 6 મીટર યોડી સડક, પશ્ચિમ: ડૉ. રિયાજ કો બુમિ	16-08-2025' ર. 83077/-	3-આગસ્ટ-25
10	રશ્મિય અગ્રા કુમાર સિંહ (કર્જદાર), રિધિકા ઉપાધ્યાયકારી - અનુરુપ કુમાર સિંહ (પુત્ર - રશ્મિય અગ્રા કુમાર સિંહ) (સહ-કર્જદાર), વિનિતી કુમાર શ્રીરાવલ (ઝમાનતી), મકાન નંમર 01 યાગ ક્ષાપુર, અક્કલગંજ અક્કલગંજ વિઝનતી ઉત્તર પ્રદેશ 246722. LHKQFO0001576609.	પ્લોટ સંખ્યા-૫-58, હસરા સંખ્યા-316 ૫ પામ વૈલી, ગ્રામ- પપનામક પરગના, તહસીલ-૫૫ જિલ્લ- લખનવક ઉત્તર પ્રદેશ 225408કા બાગ સીમાર્ન- ઉત્તર પ્લોટ સંખ્યા ૫-57, દક્ષિણ	21-08-2025' ર. 1021446/-	3-આગસ્ટ-25
11	રશ્મિય અગ્રા કુમાર સિંહ (કર્જદાર), રિધિકા ઉપાધ્યાયકારી - અનુરુપ કુમાર સિંહ (પુત્ર - રશ્મિય અગ્રા કુમાર સિંહ) (સહ-કર્જદાર), વિનિતી કુમાર શ્રીરાવલ (ઝમાનતી), મકાન નંમર 01 યાગ ક્ષાપુર, અક્કલગંજ અક્કલગંજ વિઝનતી ઉત્તર પ્રદેશ 246722. LHKQFO0001576610.	પ્લોટ સંખ્યા-૫-58, હસરા સંખ્યા-316 ૫ પામ વૈલી, ગ્રામ- પપનામક પરગના, તહસીલ-૫૫ જિલ્લ- લખનવક ઉત્તર પ્રદેશ 225408કા બાગ સીમાર્ન- ઉત્તર પ્લોટ સંખ્યા ૫-57, દક્ષિણ પ્લોટ સંખ્યા ૫-59, પૂર્વ: પ્લોટ સંખ્યા ૫-89 અને ૫-90 કા બાગ, પશ્ચિમ: 30 પંદેર યોડી સડક	21-08-2025' ર. 96252/-	3-આગસ્ટ-25
12	આર્ય વિભાવી (કર્જદાર), અમન વિભાવી (સહ-કર્જદાર), રાજેશ કુમાર (સહ-કર્જદાર), 117 નં 341 શિવપુરી કાકાદેવ કાનપુર કાનપુર ઉત્તર પ્રદેશ 208025. LHKAN000001546330.	મકાન સંખ્યા 117/ની-1/341 શિવ પુરી, આરાજી સંખ્યા 758 પર્ નિર્મિત, ગ્રામ વિનાયકપુર, કાનપુર ઉત્તર પ્રદેશ 208024, સીમાર્ન- ઉત્તર: પાખેડય જી કા પ્લોટ, દક્ષિણ: આરાજી કા યાગ, પૂર્વ: 15 પંદેર રોડ, પશ્ચિમ: ભગવાન સરદ પાખેડય કા પ્લોટ	16-08-2025' ર. 2233685/-	3-આગસ્ટ-25
13	રાજેશ કુમાર (કર્જદાર), કમલા દેવી (સહ-કર્જદાર), 123 453 ૫ ફાલગંજ કાનપુર હરદગંજ કાનપુર ઉત્તર પ્રદેશ 208021. LHKAN000015061115.	પ્લોટ સંખ્યા 3,4, 5, આરાજી સંખ્યા 2 ઓર ૩ પર, ગ્રામ વિનાયગા પરગના, કાનપુર નગર, ઉત્તર પ્રદેશ 208001. સીમાર્ન- ઉત્તર: પ્રમા સિંહ કા મકાન, દક્ષિણ: 60 પંદેર યોડી સડક, પૂર્વ: 30 પંદેર યોડી સડક, પશ્ચિમ: પ્રોથિય સિંહ કા મકાન	16-08-2025' ર. 65068.92/-	3-આગસ્ટ-25
14	રાજેશ કુમાર (કર્જદાર), કમલા દેવી (સહ-કર્જદાર), 123 453 ૫ ફાલગંજ કાનપુર હરદગંજ કાનપુર ઉત્તર પ્રદેશ 208021. LHKAN000001506116.	પ્લોટ સંખ્યા 3,4, 5, આરાજી સંખ્યા 2 ઓર ૩ પર, ગ્રામ વિનાયગા પરગના, કાનપુર નગર, ઉત્તર પ્રદેશ 208001. સીમાર્ન- ઉત્તર: પ્રમા સિંહ કા મકાન, દક્ષિણ: 60 પંદેર યોડી સડક, પૂર્વ: 30 પંદેર યોડી સડક, પશ્ચિમ: પ્રોથિય સિંહ કા મકાન	16-08-2025' ર. 2392971.26/-	3-આગસ્ટ-25
15	સુનિતા કુમાર (કર્જદાર), સુષમા મૈર્ન (સહ-કર્જદાર), 546 હુડા કાલીની નરપા હેડા પામ માકન નાર લખનવ, 546 હુડા કાલીની નરપા હેડા પામ માકન નાર લખનવ 546, હુડા કાલીની નરપા હેડા, પામ માકન નાર લખનવ, લખનવ લખનવક ઉત્તર પ્રદેશ 226011. LHLUC00001474577.	હસરા સંખ્યા 455 થા પ્લોટ યાગ, શ્રવણ સિંહ પ્રોજેક્ટ માટી પરગના હુડા, તહસીલ નવાબગંજ, વારાબંકી, ઉત્તર પ્રદેશ 225001 નં મિથા સીમાર્ન- ઉત્તર: પ્લોટ સંખ્યા સી-44, દક્ષિણ: પ્લોટ સંખ્યા સી-52, પૂર્વ: પ્લોટ સંખ્યા સી-46, પશ્ચિમ: 30 પંદેર યોડી સડક	16-08-2025' ર. 439599/-	3-આગસ્ટ-25
16	મોહમ્મદ સહમ (કર્જદાર), હમીદ નગર (સહ-કર્જદાર), જૈનુ નિશા (સહ-કર્જદાર), પ્લોટ નંમર 7, હસરા નંમર 169 રોહમ નગર દુદીલી ફેઝુલાંગાંજ લખનવ ઉત્તર પ્રદેશ 226029. LHLUC000015541314.	પ્લોટ સંખ્યા 07, હસરા સંખ્યા 169, રોહમ નગર, દુદીલી વાર્ડ, ફેઝુલાંગાંજ, પરગના, તહસીલ-૫૫ જિલ્લા લખનવક- 226020 નં મિથા. સીમાર્ન- ઉત્તર: ઝાતાવ પ્લોટ, દક્ષિણ: 16 પંદેર યોડી સડક, પૂર્વ પ્લોટ સંખ્યા 08, પ્લોટ સંખ્યા 08	16-08-2025' ર. 1031087.38/-	3-આગસ્ટ-25
17	મોહમ્મદ ફહામ (કર્જદાર), ફહરાઝ ઝમાલ (સહ-કર્જદાર), 431/927, કેપેલેસ રોડ મોહન નગર રમણ લેન્ડસીડે મોહી, પૈટ, પૈટ, અંબેડકાર નગર, ઉત્તર પ્રદેશ, 226003. LHKAN000001658694.	મકાન સંખ્યા-551કા/321થા, શકિત નગર, ખિસાવાં વાર્ડ- ગીતાપા ની, જિલા-લખનવક 227308 નં મિથા.1 સીમાર્ન- ઉત્તર: અંબેડકાર નગર, પશ્ચિમ: પૈટ, પૈટ, અંબેડકાર નગર કા મકાન, પશ્ચિમ: સૂરજ નારાયણ કા મકાન	16-08-2025' ર. 5579017.82/-	8-આગસ્ટ-25
18	આશીષ મિશ્રા (કર્જદાર), અર્ચના દેવી (સહ-કર્જદાર), યોષિતિ પવનકુમાર મેહતા (સહ-કર્જદાર), યોષિતા પાંડે (સહ-કર્જદાર), મૈનુ મિશ્રા (સહ-કર્જદાર), વંદના અધિકેશ રામચૂર (સહ-કર્જદાર), આરસ અભિવંશ રેડ ફેઝ, 3/419 વિરામ હાંડ ગોમતી નગર 3/419 વિરામ હાંડ લખનવ, લખનવ લખનવક ઉત્તર પ્રદેશ 226010. LHLUC000001358525.	મકાન સંખ્યા 3/419, વિરામ હાંડ, ગોમતી નગર યોજના, લખનવ, ઉત્તર પ્રદેશ 226010 નં મિથા સીમાર્ન- ઉત્તર: 9 મીટર યોડી સડક, દક્ષિણ પ્લોટ સંખ્યા 3/441 ઓર 442, પૂર્વ: પ્લોટ સંખ્યા 3/418, પશ્ચિમ: પ્લોટ સંખ્યા 3/420	16-08-2025' ર. 1428439/-	3-આગસ્ટ-25
19	આશીષ મિશ્રા (કર્જદાર), અર્ચના દેવી (સહ-કર્જદાર), યોષિતિ પવનકુમાર મેહતા (સહ-કર્જદાર), યોષિતા પાંડે (સહ-કર્જદાર), મૈનુ મિશ્રા (સહ-કર્જદાર), વંદના અધિકેશ રામચૂર (સહ-કર્જદાર), આરસ અભિવંશ રેડ ફેઝ, 3/419 વિરામ હાંડ ગોમતી નગર 3/419 વિરામ હાંડ લખનવ, લખનવ લખનવક ઉત્તર પ્રદેશ 226010. LHLUC000001358525.	મકાન સંખ્યા 3/419, વિરામ હાંડ, ગોમતી નગર યોજના, લખનવ, ઉત્તર પ્રદેશ 226010 નં મિથા સીમાર્ન- ઉત્તર: 9 મીટર યોડી સડક, દક્ષિણ પ્લોટ સંખ્યા 3/441 ઓર 442, પૂર્વ: પ્લોટ સંખ્યા 3/418, પશ્ચિમ: પ્લોટ સંખ્યા 3/420	16-08-2025' ર. 762838/-	3-આગસ્ટ-25
20	આશીષ મિશ્રા (કર્જદાર), અર્ચના દેવી (સહ-કર્જદાર), યોષિતિ પવનકુમાર મેહતા (સહ-કર્જદાર), યોષિતા પાંડે (સહ-કર્જદાર), મૈનુ મિશ્રા (સહ-કર્જદાર), વંદના અધિકેશ રામચૂર (સહ-કર્જદાર), આરસ અભિવંશ રેડ ફેઝ, 3/419 વિરામ હાંડ ગોમતી નગર 3/419 વિરામ હાંડ લખનવ, લખનવ લખનવક ઉત્તર પ્રદેશ 226010. LHLUC000001356976.	મકાન સંખ્યા 3/419, વિરામ હાંડ, ગોમતી નગર યોજના, લખનવ, ઉત્તર પ્રદેશ 226010 નં મિથા સીમાર્ન- ઉત્તર: 9 મીટર યોડી સડક, દક્ષિણ પ્લોટ સંખ્યા 3/441 ઓર 442, પૂર્વ: પ્લોટ સંખ્યા 3/418, પશ્ચિમ: પ્લોટ સંખ્યા 3/420	16-08-2025' ર. 1569178/-	3-આગસ્ટ-25
21	આશીષ મિશ્રા (કર્જદાર), અર્ચના દેવી (સહ-કર્જદાર), યોષિતિ પવનકુમાર મેહતા (સહ-કર્જદાર), યોષિતા પાંડે (સહ-કર્જદાર), મૈનુ મિશ્રા (સહ-કર્જદાર), વંદના અધિકેશ રામચૂર (સહ-કર્જદાર), આરસ અભિવંશ રેડ ફેઝ, 3/419 વિરામ હાંડ ગોમતી નગર 3/419 વિરામ હાંડ લખનવ, લખનવ લખનવક ઉત્તર પ્રદેશ 226010. LHLUC000001356977.	મકાન સંખ્યા 3/419, વિરામ હાંડ, ગોમતી નગર યોજના, લખનવ, ઉત્તર પ્રદેશ 226010 નં મિથા સીમાર્ન- ઉત્તર: 9 મીટર યોડી સડક, દક્ષિણ પ્લોટ સંખ્યા 3/441 ઓર 442, પૂર્વ: પ્લોટ સંખ્યા 3/418, પશ્ચિમ: પ્લોટ સંખ્યા 3/420	16-08-2025' ર. 75194/-	3-આગસ્ટ-25
22	અનિલ કુમાર મુખા (કર્જદાર), ચંદા રેખા (સહ-કર્જદાર), 40 જીપક નીલમ વિહાર કોલોની અર્ધિત માલિકવાદ માનિયાવાદ માનિયાવાદ ઉત્તર પ્રદેશ 201010. LHLUC000001552793.	(ઈ-વી)ઓ ક્યાર્નેડ મિશ્ર, રોમિત કા ડબ્લ્યુ-વી.ઓ, એસ-17) હસરા સંખ્યા 1952, ગ્રામ પિરપગાંવ, તહસીલ- નરવલ, કાનપુર, ઉત્તર પ્રદેશ 207505 નં મિથા સીમાર્ન- ઉત્તર: અન્ય આરાજી, દક્ષિણ: 17 પંદેર યોડી સડક, પૂર્વ: ક્યાર્નેડ મિશ્ર કા પ્લોટ, પશ્ચિમ: રોમિત કા પ્લોટ	16-08-2025' ર. 3986924/-	3-આગસ્ટ-25
23	અનિલ કુમાર મુખા (કર્જદાર), ચંદા રેખા (સહ-કર્જદાર), 40 જીપક નીલમ વિહાર કોલોની અર્ધિત માલિકવાદ માનિયાવાદ માનિયાવાદ ઉત્તર પ્રદેશ 201010. LHLUC000001552794.	(ઈ-વી)ઓ ક્યાર્નેડ મિશ્ર, રોમિત કા ડબ્લ્યુ-વી.ઓ, એસ-17) હસરા સંખ્યા 1952, ગ્રામ પિરપગાંવ, તહસીલ- નરવલ, કાનપુર, ઉત્તર પ્રદેશ 207505 નં મિથા સીમાર્ન- ઉત્તર: અન્ય આરાજી, દક્ષિણ: 17 પંદેર યોડી સડક, પૂર્વ: ક્યાર્નેડ મિશ્ર કા પ્લોટ, પશ્ચિમ: રોમિત કા પ્લોટ	16-08-2025' ર. 83603/-	3-આગસ્ટ-25
24	અનિલ કુમાર મુખા (કર્જદાર), ચંદા રેખા (સહ-કર્જદાર), 40 જીપક નીલમ વિહાર કોલોની અર્ધિત માલિકવાદ માનિયાવાદ માનિયાવાદ ઉત્તર પ્રદેશ 201010. LHLUC000001552795.	(ઈ-વી)ઓ ક્યાર્નેડ મિશ્ર, રોમિત કા ડબ્લ્યુ-વી.ઓ, એસ-17) હસરા સંખ્યા 1952, ગ્રામ પિરપગાંવ, તહસીલ- નરવલ, કાનપુર, ઉત્તર પ્રદેશ 207505 નં મિથા સીમાર્ન- ઉત્તર: અન્ય આરાજી, દક્ષિણ: 17 પંદેર યોડી સડક, પૂર્વ: ક્યાર્નેડ મિશ્ર કા પ્લોટ, પશ્ચિમ: રોમિત કા પ્લોટ	16-08-2025' ર. 3986924/-	3-આગસ્ટ-25

નોટીસ કો પ્રતિચાલિત તામીલ કે અંગ્રીક કમર ડા જા રહે. ૧) ઉપરોક્ત કર્જદારો ઓર યા. પૂર્વે ગારંટરો (જેસા લાગુ હો) કો સહાઈ ડી જાતી હૈ ફિ કે યેસ નોટીસ કે પ્રકાશન કો નિધિ સે 60 દિનેં કો અધીષ કે ખોતર વચવાય કા પુઠાન કરે અન્યા ધિયાર આસિરનો કે પ્રતિખીતકામ અને પુર્નિર્માન યાત્રા પ્રતિનિધિ લિટ કા વર્ધન અર્ધિનમય, 2002 કે પ્રાવધાની કે અનુરુપ ઓ કો કાર્યારંધ કો નિર્ધારિત. ૦૩.૦૫.2025

રિયાજ: રેલાવાબાદ, વારાબંકી, ગોલપુર, કાનપુર, લખનવ, રાયવોલી, રાયવોલી, વાપાણી

આઈસીઆઈઆઈ હોમ ફાઇનાન્સ લિમિટેડ